



BBH-001-2342003

Seat No. _____

M. A. (Sem. II) (CBCS) (WEF-2019) Examination

July - 2021

Geography : Paper-8

(Soil and Bio-Geography)

(New Course)

Faculty Code : 001

Subject Code : 2342003

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (1) બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.
(2) કોઈપણ પાંચ પ્રશ્નોના ઉત્તરો આપો.

- 1 જીવ ભૂગોળનો અર્થ આપી, તેનું કાર્યક્ષેત્ર અને મહત્ત્વ વિગતે સમજાવો. 14
- 2 પરિસ્થિતિ વિજ્ઞાનના સંદર્ભમાં પૃથ્વી પરનું જૈવશક્તિ ઘટનાયક વિગતે સમજાવો. 14
- 3 જમીન નિર્માણ ક્રિયા વિગતે સમજાવી, તેના સંરક્ષણ પર વિગતે નોંધ લખો. 14
- 4 ભારતના જૈવ-ભૌગોલિક પ્રદેશો પર વિગતે ભૌગોલિક અહેવાલ આપો. 14
- 5 જૈવ-વિવિધતા પર માનવ પ્રવૃત્તિની અસરોની વિગતે ચર્ચા કરો. 14
- 6 દુનિયાના કુદરતી પ્રદેશોનો પ્રાણીજીવન અને વનસ્પતિસૃષ્ટિ સાથેનો આંતરસંબંધ વિગતે સમજાવો. 14
- 7 ભારતના જંગલો પર વિગતે ભૌગોલિક નોંધ લખી ભારતની રાષ્ટ્રીય વનનીતિ ટૂંકમાં સમજાવો. 14

- 8 દુનિયામાં જંગલો અને હિંસક પ્રાણીઓના સંરક્ષણ માટે થતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રયત્નો પર વિગતે માહિતી આપો. 14
- 9 ટૂંકનોંધ લખો : 14
(1) પરિસ્થિતિ વિજ્ઞાન અને આહાર શૃંખલા.
(2) સામુદ્રિક જીવવિજ્ઞાન.
- 10 ટૂંકનોંધ લખો : 14
(1) દુનિયાના મુખ્ય રણપ્રદેશો.
(2) જીવવિજ્ઞાન વિષયક સંસાધનો.

ENGLISH VERSION

- Instructions :** (1) All questions are equal marks.
(2) Answer any five questions.

- 1 Give the meaning of bio-geography and explain in detail the scope and significance of them. 14
- 2 Explain in detail the terrestrial cycle of bio energy with special reference to eco-system. 14
- 3 Explain in detail the soil formation and write a detail note on conservation of them. 14
- 4 Give a detailed geographical account on bio-geographical regions of India. 14
- 5 Discuss in detail the effects of human activity on Bio-diversities. 14
- 6 Explain in detail the inter-relations of plant and animal life with ecological regions of world. 14

- 7 Write a detail geographical notes on the forests of India 14
and explain in brief the national forest policy of India.
- 8 Give a detail information on National and international 14
efforts for the conservation of forests and wild life in the
world.
- 9 Write short notes : 14
(1) Ecosystem and food chain.
(2) Marine ecology.
- 10 Write short notes : 14
(1) Major desert regions of the world.
(2) Biological resources.
-